

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વસો કેમ્પસ ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિને દેશનાં ભાવી કૃષિકારોનું અનોખું અભિવાદન.

કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ પોલિટેકનિક, આણંદ કૃષિ યુનિવર્સિટી, વસો ખાતે ૭૫ મો સ્વાતંત્રતા દિવસ ઉજવણીનો કાર્યક્રમ હર્ષભેર ઉજવવામાં આવ્યો. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં બંને કોલેજનાં પ્રાધ્યાપક ગણ, કર્મચારી ગણ, વિદ્યાર્થી ગણ, સિક્યુરીટી સ્ટાફ, કેમ્પસમાં રહેતા વસાહતી ભાઈ-બહેનો તેમજ ખેતીકામ સાથે સંકળાયેલ રોજમદાર વર્ગે પણ ખૂબજ હર્ષો ઉલ્લાસથી ભાગ લીધો હતો.

વધુમાં બંને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તેમજ કેમ્પસમાં રહેતાં સર્વેમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તથા તેઓમાં રહેલ કૌશલ્ય ઉજાગર થાય તે હેતુથી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનાં ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો જેવા કે પોસ્ટર સ્પર્ધા, દેશ ભક્તિ ગીત, રાષ્ટ્ર માટે ઉત્સાહ વર્ધક વક્તવ્ય વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કોવીડ-૧૯ નાં લીધે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ કેમ્પસ પર હાજર તેમજ ઘરે રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ ઓન-લાઈન રહી ખૂબજ ઉત્સાહ ભેર દરેક ઈવેન્ટમાં ભાગ લીધેલ હતો.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની મુખ્ય અને ઉત્તેજના દાયક બાબત એ રહી કે આ વર્ષે કૃષિ પોલિટેકનિકમાં અભ્યાસ પૂર્ણ કરેલ અને સુવર્ણપદક મેળવેલ વિદ્યાર્થી શ્રી સૂરજ ઠાકોરના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પ્રવર્તમાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુ કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ પોલિટેકનિકના છેલ્લા ૩ (ત્રણ) વર્ષનાં તેજશ્વી તારલાઓનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કરવામાં આવેલ. આ તારલાઓ પૈકી શ્રી જયેશ દેસાઈ દ્વારા હાલમાં કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે યોગ્ય માર્ગદર્શન પુરું પાડવામાં આવેલ તેમજ અન્ય વિદ્યાર્થી તારલાઓએ પણ ઉત્સાહ પ્રેરક વક્તવ્ય રજૂ કર્યા હતા.

આ સમગ્ર ઉજવણી આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ સ્ટાફગણની જહેમત તથા વિદ્યાર્થીઓનાં ઉમળકાભેર ઉત્સાહ પૂર્વકની ભાગીદારીથી, સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરી સફળતા પૂર્વક પૂર્ણ કરેલ.

કૃષિ પોલિટેકનિકનાં સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થી શ્રીસૂરજ ઠાકોરનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આચાર્યશ્રીએ જય જવાન - જય કિશાન - જય વિજ્ઞાન - જય અનુસંધાન ચરિતાર્થ કરી રાષ્ટ્રનાં વિકાસમાં સહભાગી થવા સૌને અપીલ કરી.